

S

SARDAR PATEL UNIVERSITY
B.Com. (V - Semester) Examination
Tuesday, 17th April, 2018
2.00 pm - 4.00 pm
UB05CCOM10 - Financial Mgt.

Total Marks : 60

પ્ર.૧ ટૂંકનોંધ લખો : (૧૫)

- (અ) નાણાં સંચાલનનું કાર્યક્ષેત્ર
- (બ) નાણાં કાર્યનું વર્ગીકરણ

અથવા

પ્ર.૧ નાણાંકિય નિર્ણયોમાં નાણાં મેનેજરના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો. (૧૫)

પ્ર.૨

(અ) નાણાંકિય આચ્યોજનને અસરકર્તા પરિબળો સમજાવો. (૦૮)
 (બ) નાણાંકિય આચ્યોજનની મર્યાદાઓ ચર્ચો. (૦૭)

અથવા

પ્ર.૨ અલ્પમૂડીકરણ એટલે શું? તેના કારણો-અસરો અને ઉપાયોની ચર્ચા કરો. (૧૫)

પ્ર.૩ ટૂંકનોંધ લખો : (૧૫)

- (અ) જાહેર થાપણો
- (બ) વિદેશી મૂડી

અથવા

પ્ર.૩ ટૂંકનોંધ લખો : (૧૫)

- (અ) આંતરિક નાણાં વ્યવસ્થા
- (બ) વેપારી બેંક

પ્ર.૪ મૂડી બજેટ એટલે શું. તેનું મહત્વ સમજાવો. (૧૫)

અથવા

પ્ર.૪ એક કંપની મૂડી રોકાણાની એક ચોજનામાં રૂ. ૪૦૦૦૦ રોકવાનું વિચારે છે. તેનું શેખમૂલ્ય કે (૧૫)

બંગાર કિંમત કાંઈ જ નથી તેનું ઉપયોગી આયુષ્ય પાંચ વર્ષનું છે. કરવેરાનો દર ૫૦% છે.

કંપની ઘસારા માટે સીધી લીટીની પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેનો ઘસારો તથા કરવેરા પહેલાંનો નકો નીચે મુજબ છે.

વર્ષ	નકો
૧	૮૦૦૦
૨	૮૮૦૦
૩	૯૧૨૦૦
૪	૧૨૦૦૦
૫	૨૦૦૦૦

ઉપરની વિગતો પરથી હિસાબી વળતરનો દર કે સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધો.

----- X -----

SARDAR PATEL UNIVERSITY
B.Com. (V - Semester) Examination
Tuesday, 17th April, 2018
2.00 pm - 4.00 pm
UB05CCOM10 - Financial Mgt.

Total Marks : 60

- Q.1 Write short notes : (15)
 (A) Scope of financial Mgt.
 (B) Classification of Finance Functions
 OR
 Q.1 Discuss the Role of Finance Manager in Financial decision in detail. (15)
- Q.2 (A) Explain the factors affecting Financial Planning. (08)
 (B) Discuss the Limitation of Financial Planning. (07)
 OR
 Q.2 What is undercapitalization? Discuss its Causes, Effects and Remedies. (15)
- Q.3 Write short notes : (15)
 (A) Public Deposits
 (B) Foreign Capital
 OR
 Q.3 Write short notes : (15)
 (A) Internal Financing
 (B) Commercial Banks
- Q.4 What is capital budget? Explain its Importance. (15)
 OR
 Q.4 A company is considering to invest Rs. 40000 in a capital project. Its scrap value is nil. Its useful life is 5 years Tax rate is 50%. (15)
 The Company adopts the straight Line Method of depreciation.
 The profit before depreciation and Tax is as follows.

Year	Profit
1	8000
2	8800
3	11200
4	12000
5	20000

On the basis of above information calculate the rate of return on average investment.